



The Kalol Nagarik Sahakari Bank Ltd.

Nagarik Bank Char Rasta, College Road, KALOL (N.G.) 382721
Ph. : (02764) 225100, 222514, 223328,

54 Annual Report
2022-2023

SINCE -1969




Home Loan

Business Loan

Vehicle Loan

Debit Card



E-mail : ho@knsbl.co.in

website : <https://www.knsbl.co.in>




ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)


બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શ્રી




શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ
ચેરપર્સનશ્રી




શ્રી રશ્મીકાંત અરવિંદલાલ દેસાઇ
વાઈસ ચેરમેનશ્રી



શ્રી શ્રેણીકલાઇ અશોકલાઇ શાહ (C.A.)
મેનેજિંગ ડીરેક્ટરશ્રી



શ્રી બાબુલાઇ પ્રભુદાસ પટેલ
જોઈન્ટ મેનેજિંગ ડીરેક્ટરશ્રી



શ્રી ચિરાગકુમાર ગોવિંદલાઇ પટેલ
ડીરેક્ટરશ્રી



શ્રી દિપકકુમાર વિહલદાસ પટેલ
ડીરેક્ટરશ્રી



શ્રી ધવલકુમાર શૈલેષલાઇ પટેલ
ડીરેક્ટરશ્રી




શ્રી ગણપતલાઇ અંબાલાલ પટેલ
ડીરેક્ટરશ્રી



શ્રી જયેશકુમાર નટવરલાલ પટેલ
ડીરેક્ટરશ્રી




શ્રી નિલેશકુમાર ગુણવંતલાલ પટેલ
ડીરેક્ટરશ્રી



શ્રી પ્રમોદલાઇ કાન્તિલાલ પટેલ
ડીરેક્ટરશ્રી



શ્રી રાજેન્દ્રલાઇ શાંતિલાલ શાહ
ડીરેક્ટરશ્રી



શ્રી જીગ્નેશકુમાર શૈલેષલાઇ પટેલ
ડીરેક્ટરશ્રી



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)

GSTIN 24AACFT1904G1ZM

PAN - AACFT1904G

કલોલ (ઉ.ગુ.) ૩૮૨૭૨૧.

૨૦૨૨-૨૦૨૩

TAN - AHMT01321F

IFSC - IBKL01282KB

RBI Licence No.: UBD GJ 943 P - 10th December 1987

રજી. નં. ૧૫૪૯ તા. ૯-૯-૧૯૬૯ ઓડીટ વર્ગ : “અ” કામકાજ શરૂ કર્યા તારીખ : ૧૬-૨-૧૯૭૦

બોર્ડ ઓફ ડીરેક્ટર્સ

શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ
ચેરપર્સનશ્રી

શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ
વાઇસ ચેરમેનશ્રી

શ્રી ચિરાગકુમાર ગોવિંદભાઈ પટેલ
શ્રી દિપકકુમાર વિઠ્ઠલદાસ પટેલ
શ્રી ઘવલકુમાર શૈલેષભાઈ પટેલ
શ્રી ગણપતભાઈ અંબાલાલ પટેલ
શ્રી જયેશકુમાર નટવરલાલ પટેલ

શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ (C.A.)
મેનેજિંગ ડીરેક્ટરશ્રી

શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ
બોનટ મેનેજિંગ ડીરેક્ટરશ્રી

શ્રી નિલેશકુમાર ગુણવંતલાલ પટેલ
શ્રી પ્રમોદભાઈ કાન્તિલાલ પટેલ
શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહ
શ્રી જીગ્નેશકુમાર શૈલેષભાઈ પટેલ

શ્રી પરેશભાઈ રમેશચંદ્ર બેઠી

બનરલ મેનેજરશ્રી/સી.ઇ.ઓ

: ઓડીટર્સ :

આર. એસ. પટેલ & કું.

ફર્મ રજી નં. ૧૦૭૭૫૮W

C.A. રાજન બી. શાહ (પાર્ટનર)

મેમ્બરશીપ નં. : ૧૦૧૯૯૮

UDIN : 22101998AMMPX17038

લીગલ એડવાઇઝર્સ : આર. એમ. શાહ એન્ડ કું. મધુબન, ટાઉન હોલ પાછળ, રેલ્વે કોર્સીંગ પાસે, અમદાવાદ.

બેન્કર્સ

- ધી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક લી. અમદાવાદ.
- ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓ. બેન્ક લી., કલોલ.
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, કલોલ.
- આઈ.ડી.બી.આઈ. બેન્ક, કલોલ, મહેસાણા.
- બેન્ક ઓફ બરોડા, કલોલ, આંબલીયાસણ.
- યુકો બેંક, કલોલ.
- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ.
- આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, કલોલ.
- કોટક મહિન્દ્રા બેન્ક, કલોલ.
- ઈન્ડુસીડ બેન્ક, અમદાવાદ.
- એકસીસ બેંક, કલોલ.
- ધી મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક આંબલીયાસણ.
- ધી કાલુપુર કો.ઓ.બેન્ક લી. અમદાવાદ.

શેર ભંડોળ અને અન્ય ભંડોળ

અધિકૃત શેર ભંડોળ	રૂ. ૧૨,૦૦,૦૦,૦૦૦-૦૦
ભરપાઈ થયેલ શેર ભંડોળ	રૂ. ૧૧,૮૩,૧૪,૮૫૦-૦૦
રિઝર્વ ફંડ તથા અન્ય ફંડો	રૂ. ૩૬,૫૫,૪૧,૮૭૦-૧૪

કુલ થાપણ અને કાર્યભંડોળ

થાપણો	રૂ. ૩૬૫,૧૫,૬૯,૦૧૭-૦૩
વર્કિંગ કેપીટલ	રૂ. ૪૨૫,૦૭,૬૮,૧૯૭-૩૮
નફો	રૂ. ૩,૨૨,૧૧,૧૧૧-૦૦



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)

નોટીસ

ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિ.કલોલ, (ઉ.ગુ.) ના તમામ સભાસદ ભાઈ-બહેનોને આથી વિનંતી કરવામાં આવે છે. કે :-

આ બેન્કની વાર્ષિક સાધારણ સભા તા. ૦૮-૦૮-૨૦૨૩ ને બુધવાર ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, નાગરિક બેન્ક ચાર રસ્તા, કોલેજ રોડ, કલોલમાં નીચે જણાવેલ કામો અંગે મળશે તો દરેક સભાસદોને સમયસર પધારવા વિનંતી છે.

કામની વિગત

- (૧) તા. ૨૭-૧૨-૨૦૨૨ ના રોજ મળેલી ખાસ સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા બાબત.
- (૨) બેન્કના તા.૩૧-૦૩-૨૦૨૩ ના આખરે પૂરા થતા વર્ષનો સંચાલક મંડળે રજૂ કરેલ વાર્ષિક અહેવાલ, સરવૈયું, નફા નુકશાનનો હિસાબ તથા નફાની ફાળવણી નો હિસાબ તથા ઓડીટ થયેલ ઓડીટર્સ રીપોર્ટ મંજૂર કરવા બાબત.
- (૩) તા. ૩૧-૦૩-૨૦૨૩ ના આખર ના નફાની વહેંચણી તથા ફાળવણી મંજૂર કરવા બાબત.
- (૪) શેરોની ભરાયેલ રકમ ઉપર ડિવીડન્ડ વહેંચણી જાહેર કરવા બાબત.
- (૫) સને ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ સ્ટેચ્યુટરી ઓડીટરની નિમણૂક તથા તેમના મહેનતાણા બાબતે.
- (૬) સને ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષના બેન્કે વધારેમાં વધારે કરવાના કરજ ની હદ નક્કી કરવા બાબત.
- (૭) સને ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષ માટે બજેટ નક્કી કરવા બાબત.
- (૮) બેંકના મુદત વિતી બાકીદારોને સરકાર શ્રી ની વનટાઈમ સેટલમેન્ટ યોજના મુજબ તેમજ વ્યાજ રાહતની આવેલ અરજીઓ અંગે સમાધાન દ્વારા કરેલ વસુલાતની નોંધ લઈ તેને બહાલી આપવા બાબતે.
- (૯) મે. પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કંઈ રજુ થાય તે અંગે વિચારણા કરવા બાબતે.

કલોલ (ઉ.ગુ.)
તા. ૧૫-૦૭-૨૦૨૩

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના હુકમથી
શ્રી પરેશભાઈ આર. જોષી
જનરલ મેનેજરશ્રી

- નોંધ : (૧) બેન્કના હિસાબો સંબંધી કોઈ પુછપરછ કરવી હોય તો મીટીંગની તારીખ અગાઉ સાત દિવસ પહેલાં બેન્કની ઓફિસે કામકાજના સમય દરમ્યાન મેનેજરશ્રીનો સંપર્ક સાધવો.
- (૨) કોરમના અભાવે મીટીંગ મુલતવી રહેશે તો તે જ દિવસે અડધા કલાક બાદ તે જ સ્થળે ફરીથી મળશે.
- (૩) જે સભાસદોને વાર્ષિક અહેવાલની નકલ જોઈતી હશે તેઓને બેન્કની મુખ્ય કચેરી, શેર વિભાગમાંથી બેન્કના કામકાજના સમય દરમ્યાન મેળવી લેવા વિનંતી છે.
- (૪) બેંકના વાર્ષિક હિસાબોની નકલ બેંકની તમામ બ્રાન્ચોમાં મુકવામાં આવેલ છે.



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)

ફીક્સ ડીપોઝીટ ઉપર વ્યાજના દર (તા. ૧૮-૦૪-૨૦૨૩ થી અમલ)

મુદત	વ્યાજનો દર	(૧) સીનીયર સીટીઝનને પુરાવો રજુ કર્યાથી ૦.૫૦ % વ્યાજ વધુ આપવામાં આવશે. (બાર માસ કે તેથી વધુ ની મુદત માટે)
૦૭ દિવસ થી ૨૮ દિવસ સુધી	૩.૫૦ %	(૨) સેવિંગ્સ ડિપોઝીટ પર વ્યાજનો દર તા. ૧૮-૦૩-૨૦૨૨ થી ૩.૫૦ % રહેશે.
૩૦ દિવસ થી ૯૦ દિવસ સુધી	૪.૫૦ %	
૯૧ દિવસ થી ૧૮૦ દિવસ સુધી	૫.૫૦ %	
૧૮૧ દિવસ થી ૩૬૪ દિવસ સુધી	૫.૭૫ %	
૧૨ માસ થી ૨૩ માસ સુધી	૬.૫૦ %	
૨૪ માસ થી ૩૬ માસ સુધી	૬.૭૫ %	
૩૭ માસ થી વધુ	૫.૫૦ %	
૭૭૭ દિવસ	૭.૦૦ %	

રીકરીંગ ડીપોઝીટ યોજના

માસિક હપ્તાની સંખ્યા

હપ્તાની	૧૨ માસ	૨૪ માસ	૩૬ માસ	૪૮ માસ	૬૦ માસ
રકમ	૬.૫૦ %	૬.૭૫ %	૬.૭૫ %	૫.૫૦ %	૫.૫૦ %
૫૦	૬૨૧	૧૨૮૮	૧૯૯૯	૨૬૮૯	૩૪૫૮
૧૦૦	૧૨૪૩	૨૫૭૫	૩૯૯૮	૫૩૭૭	૬૯૧૫
૫૦૦	૬૨૧૪	૧૨૮૭૬	૧૯૯૯૧	૨૬૮૮૫	૩૪૫૭૬
૧૦૦૦	૧૨૪૨૯	૨૫૭૫૩	૩૯૯૮૧	૫૩૭૭૧	૬૯૧૫૨

ઉપરોક્ત વ્યાજના દર રિઝર્વ બેન્કના આદેશ મુજબ વગર નોટિસે ફેરફારને પાત્ર છે.

- ❖ બેન્ક રોકાણ સંપતિવેરામાંથી મુક્તિને પાત્ર છે.
- ❖ બાંધી મુદતની થાપણો સામે લોન સગવડ તાત્કાલિક આપવામાં આવે છે.
- ❖ ઇશ્વરે આપને સમૃદ્ધિ બક્ષેલ છે. પણ તેની સુરક્ષા એ આપના હાથની વાત છે. અને બેન્ક તે કરી આપે છે.
- ❖ આપના નાણાંની બચતના આકર્ષક વળતર માટે.
- ❖ આપના ઉજવણ ભાવિ માટે.
- ❖ શુભ પ્રસંગોની ભવ્ય ઉજવણી માટે.
- ❖ આપના નાણાંની સલામતી માટે.
- ❖ બેન્કની યોજનાઓમાં આપના ફાજલ નાણાંનું રોકાણ કરો.
- ❖ બેન્કને સાર્વજનિક ટ્રસ્ટની થાપણો સ્વીકારવાની સરકારશ્રીની પરવાનગી મળેલ છે.

વધુ વિગત માટે આપ બેન્કના જનરલ મેનેજરશ્રીનો સંપર્ક સાધો.



ડિપોઝીટ	ખાતા સંખ્યા	રકમ રૂ. પૈસા
૧. બાંધી મુદતની થાપણ	૧૪૭૭૧	૨૦૭,૫૧,૨૯,૯૧૯-૪૯
૨. સેવિંગ્સ ડિપોઝીટ	૩૫૩૯૮	૧૩૩,૨૭,૩૦,૨૮૦-૧૦
૩. કરંટ ડિપોઝીટ	૫૩૫૩	૨૩,૭૨,૬૦,૦૬૭-૪૪
૪. રીકરીંગ ડિપોઝીટ	૨૦૧	૬૪,૪૮,૭૫૦-૦૦
કુલ	૫૫૭૨૩	૩૬૫,૧૫,૬૯,૦૧૭-૦૩

૫. ધિરાણ

આપણી બેન્કે ચાલુ વર્ષના અંતે કુલ ૨૩૩૪ કરજદારોને ધંધાના વિકાસ સાડું તથા સામાજિક જરૂરિયાતવાળાને પોતાની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના ધિરાણ કરેલ છે. અહેવાલના વર્ષ દરમિયાન જુદા જુદા પ્રકારના ધિરાણની પ્રવૃત્તિઓમાં પણ વધારો થયેલ છે. જે નીચેની ધિરાણની વિગત ઉપરથી જાણી શકાશે.

ધિરાણનો પ્રકાર	કરજદાર ખાતાની સંખ્યા	ધિરાણ બાકી
સ્થાવર મિલકત સામે કેશ કેડીટ	૪૫	૨૨,૨૧,૩૧,૪૪૬-૪૯
કલીન કેશ કેડીટ	૪૪૨	૩,૭૬,૯૬,૧૭૭-૪૪
માલ તારણ	૩૩૭	૩૧,૯૪,૯૨,૭૭૪-૯૨
પ્લેઝ	૦૯	૧,૧૬,૭૭,૧૬૮-૧૨
હાયર પરચેઝ	૭૪૬	૩૫,૭૦,૮૩,૪૫૩-૬૧
ગોલ્ડ લોન	૦૨	૧,૪૨,૬૦૨-૦૦
ફિક્સ ડીપોઝીટ સામે	૯૪	૨,૭૨,૫૬,૯૦૪-૨૪
રીકરીંગ ડીપોઝીટ સામે	--	---
સ્ટાફ લોન	૧૩૮	૪,૧૧,૭૯,૪૧૩-૦૫
સ્થાવર મિલકત સામે	૨૩૭	૫૨,૦૫,૬૧,૦૦૪-૦૦
મશીનરી સામે	૧૭	૧,૩૧,૩૪,૩૦૬-૫૦
સ્થાવર મિલકત સામે (અધર)	૨૬૨	૭૯,૯૭,૦૫,૨૦૬-૬૫
એજ્યુકેશન લોન	૦૫	૭૬,૭૧,૮૭૫-૦૦
કુલ	૨૩૩૪	૨૩૫,૭૭,૩૨,૩૩૨-૦૨

બેન્કના ધિરાણ બાકીદારોને જણાવવાનું કે તેઓની મુદતસર વસુલાત નહિં આવવાથી બેન્કને કાયદેસર કાર્યવાહી કરી વસુલાત કરવી પડે છે. જેથી એક યા બીજી રીતે બીજા સભાસદોને ધિરાણમાં મુશ્કેલી આવે છે. આમ ન બને તે માટે પોતાની બાકી નીકળતી રકમ તેઓ મુદત સર ભરપાઈ કરે તે માટે કાર્યવાહક મંડળ આગ્રહભરી વિનંતી કરે છે.



આદરણીય સભાસદ ભાઈઓ-બહેનો,
નમસ્કાર,

નિવેદન

“સ્થિરતા સલામતી અને અવિરત પ્રગતિ” ની પરંપરા જાળવી ને તા. ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ આપણી બેંક પોતાની બેંકીંગ કારકીર્દીના ૫૪ વર્ષ પુરા કરીને ૫૫ માં પ્રવેશ કરે છે, આજની ૫૪ મી વાર્ષિક સાધારણ સભામાં તા. ૩૧-૦૩-૨૦૨૩ ના રોજનું ઓડીટ થયેલ વાર્ષિક સરવૈયું અને નફા-નુકાસાના ના હિસાબો જે સંચાલક મંડળે માન્ય રાખેલ છે તે આપ સહુ ની સમક્ષ રજુ કરું છું. અને આજની સભામાં આપ સહુ નું સ્વાગત કરતાં આનંદ અનુભવું છું. આપના સૌના સહકારથી આપણી સૌની સહિયારી બેંકમાં ચાલુ સાલના કામકાજ અંગેના પ્રગતિના આંકડા જોઈ આપ સૌને ખુશી થશે કે. ગઈ સાલ આપણી બેંકની ડીપોઝીટ રૂ.૩૫૧૩૮.૩૬ લાખ હતી જે ચાલુ સાલે રૂ.૩૬૫૧૫.૬૯ લાખ થયેલ છે. તેમજ ધિરાણ ગઈ સાલ રૂ.૨૨૧૫૪.૬૪ લાખ હતું જે ચાલુ સાલે રૂ.૨૩૫૭૭.૩૨ લાખ થયેલ છે. તેમજ શેર મંડોળ ગઈ સાલ રૂ.૧૧૧૭.૪૫ લાખ થી ચાલુ સાલ રૂ.૧૧૮૩.૧૫ લાખ થયેલ છે જે ઉત્તરોત્તર બેંકની પ્રગતિ દર્શાવે છે અને બેંકનું કાર્યકારી મંડોળ રૂ.૪૨૫૦૭.૬૮ લાખ થયેલ છે. તેની નોંધ લેતા અમોને આનંદ થાય છે. આ બેંક આપણી પોતાની બેંક છે. જેથી તમામ પ્રકારનું બેંકીંગ કામકાજ આપણી પોતાની બેંક મારફત જ કરશો એવી આશા રાખીએ છીએ. બેંક ડીપોઝીટ વિમા પ્રિમીયમ સમયસર ભરાયેલ છે. તથા ચાલુ વર્ષની ડીપોઝીટ વિમો ભરાયેલ છે. બેંકે દરરૂબ વ્યક્તિગત સભાસદ નો ગૃપ જનતા અકસ્માત વીમો રૂ.૨,૦૦,૦૦૦-૦૦ સુધીનો શરતોને આધીન લીધેલ છે. તમજ આપણી બેંકના ગ્રાહકોને RTGS / NEFT ની સગવડ માટે બેંકે IFSC CODE મેળવેલ છે, બેંકને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા, અમદાવાદ, તરફથી નવા માઈક્રો કોડ મળેલ છે, બેંકમાં ECS કલીયરીંગ ગ્રાહકોની સગવડ માટે શરૂ કરેલ છે, બેંક નું નેટ એન.પી. એ. ૦.૫૫ % રહેલ છે.

આપણી બેંકે છેલ્લા વર્ષોમાં કરેલી પ્રગતિ અને ચાલુ વર્ષે કરેલ પ્રગતિ નફાકારતા અને વિકાસ અંગે બેંક તમામ સભાસદો, થાપણદારો, ખાતેદારોએ બેંક ઉપર વિશ્વાસ વ્યક્ત કરેલ છે. તે બેંકના વિકાસ માટે યશસ્વી અને અપ્રતિમ ફાળો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આભાર અને ધન્યવાદ માને છે.

બેંક વધુ કાર્યક્ષમ, સારી સેવા કરી શકે એ હેતુથી બેંકના કામકાજમાં સક્રિય રસ રાખી સલાહ સુચનો અને માર્ગદર્શન આપવા બદલ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા, ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી. અમદાવાદ, ગુજરાત અર્બન કો. ઓ. બેંક ફેડરેશન અમદાવાદ, ઉત્તર ગુજરાત અર્બન કો. ઓ. બેંક ફેડરેશન, મહેસાણા, ધી મહેસાણા ડી.સે. કો.ઓ. બેંક લી. કલોલ, ધી કાલુપુર કોમ. કો.ઓ. બેંક લી. અમદાવાદ તેમજ સહકારી ખાતાનો સૌ વતી આભાર માનીએ છીએ.

આપણી બેંકના તમામ પ્રકારના સભાસદ થાપણદારો તેમજ ખાતેદારો બેંક સાથે કામકાજ રાખી વિશ્વાસ વ્યક્ત કરેલ છે. તેમજ બેંક ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યોએ કોઈપણ જાતનું ભથ્થું લીધા સિવાય પોતાના કિમતી સમયનો ભોગ આપી બેંકની પ્રગતિમાં મદત્વનો ફાળો આપ્યો છે. તે બદલ તેઓ સર્વેનો આભાર માનીએ છીએ.

બંકના રાજબરાજના કાર્યોમાક્ષધાલન કરનારા બંકના જનરલ મેનેજરશ્રી તથા કર્મચારીઆમજ્જમ્મ, નિંદા તમજ ઉ.સાહ અનવગશ ખતાવી બંકની ઘ્નગતિ માટ ઘ્નમાણિકતાથી સઘાઆગ આઠ સ ઇગ તગ બદલ તમામ ધ યવાદ આઠીઅગ છીઅગ ચાલુ સાલઆઠણી બેંકરૂ. ૭૭૩-૧૧ લાખ નામકાચરસ ઇગ જમાથી રૂ. ૨૦૯-૪૩ લાખ ઇ કમટક ભરી ચામ્મમામકા. રૂ. ૩૨૨-૧૧ લાખ કરસ ઇગ

ગોહકામજ્જધુ સારી ઝડઠી સઘા ઠૂરી ઠા ઠી શકાય તરુભુથી તમામ શાખાઆઠાકુમ્મુટરાઈઝડ ઇગ બેંકની તમામ શાખાઆઠાગોહકામજ્જધુ સારી સઘા આઠી શકાય તમાટઝસી. પી. અસ. કરસ ઇગ બેંકની હઝ આઠ્ઠિસઝમ્મટી. અમ. ATM મશીનની સુવિધા ચાલુ છે, તેમજ આપની બેંકમાં “RUPAY DEBIT CARD” શરૂ કરેલ છે જેથી ભારત ભરમાં ગમે તે ATM / POS / ECOM દ્વારા વ્યહવાર થઈ શકે છે. બંક હઝ આઠ્ઠિસ કલાસ ખાતઝસઈક ઠીઠા ઠીટ વાઠ્ઠટની સુવિધા ધરાવઝગકાઠા ખો ય, આઠ્ઠલિયાસણ, સાંતેજ, મહેસાણા, રાણીપ તથા વાઠજ શાખાઆઠામ્મસઈક ઠીઠા ઠીટ વાઠ્ઠટની સુવિધા ધરાવઝગ અને હઝ આઠ્ઠિસ , સાંતેજ, ઇત્રાલ, આંબલિયાસણ, મહેસાણા, રાણીપ શાખા, માર્કેટ યાર્ડ શાખા, જી.આઈ.ડી.સી. શાખા, કાઠા શાખા, તથા વાઠજ શાખા ગ્રાહકોની સગવડ સાઠ સપૂર્ણ વાતાનું કુલીત (A.C.) ધરાવઝગ

રાજય સરકાર ઝારા આઠની બેંક “અવિકુત સ્ટેમ્પ વેન્ડર” તરીકનુઘ્ન્યાયસ સ ધરાવઝગ બેંકની મુખ્ખ આઠ્ઠિસ કલાસમાઠ્ઠકીઘ મશીન ઝારા રૂ. ૧૦,૦૦૦-૦૦ સુધી ના મુદ્દયના ષટ્ઠ નુઘ્નકીઘ કરવામાઠ્ઠમાવઝગ તેમજ આઠણી બેંકની અમદાવાદ શાખા માઠ્ઠકીઘ મશીન ઝારા રૂ. ૧૦,૦૦૦-૦૦ સુધી ના મુદ્દયના ષટ્ઠ નુઘ્નકીઘ કરવામાઠ્ઠમાવઝગ

વિશામ્મખેંકના તમામ સભાસદાઠ ખાતઠારાઠ ઠાઠા ઠાઠારાતથા શુભઠ્ઠકામ્મમારા ઉઠર મૂકસ વિ. ઠસ બદલ અમાઠ્ઠમાઠ સૂના ઝણી અઠ અનઠ્ઠમાઠ સર્વેનાઠ્ઠવિ યમાઠ્ઠાથ-સહકાર સઠ્ઠથાનઠ્ઠખળતાઠ્ઠલઠ્ઠવી અઠ ઠ્ઠા સાથઠ્ઠમાઠ સર્વે નાઠ્ઠાઈક આભાર માનીઅઠ્ઠીઅઠ

અઠ્ઠમાઠ્ઠે કના વિકાસમાઠ્ઠમાઠા ઠાઠારાઠ સભાસદાઠ શુભઠ્ઠકામ્મૂ તરફથી જઠ્ઠાથ સહકાર અનઠ્ઠાઠ્ઠસાહન મળઠ ઇઠઠઠ્ઠદલ અમાઠ્ઠમાઠ સૂનાઠા ઠાઈક આભાર માનીઅઠ્ઠીઅઠ્ઠનઠ્ઠમાઠ સૂ આઠણી બંકનઠ્ઠસઠર અનઠ્ઠાઠ્ઠઠિય ખનાવવામાઠ્ઠા ય સાથ આઠ શાઠ્ઠવી વિનઠ્ઠી કરીઅઠ્ઠીઅઠ

શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ
ચેરપર્સનશ્રી

શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ
વાઈસ ચેરમેનશ્રી

શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ
મેનેજંગ ડિરેક્ટરશ્રી

શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ
જોઈન્ટ મેનેજંગ ડિરેક્ટરશ્રી

ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રી



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનો ૫૪ મો વાર્ષિક અહેવાલ
ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

સભાસદ જોગ,

આપ સૌના સહકાર અને સહિયારા પુરૂષાર્થ થી બેન્કના તા.૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષના કામકાજ નો ૫૪ મો અહેવાલ આપની સમક્ષ રજૂ કરતા અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ.

નફો અને વહેંચણી

સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષ દરમ્યાન બેન્કની કુલ આવક રૂા. ૩૬,૮૬,૩૬,૦૩૩-૬૪ પૈસાની થઈ છે. તેમાંથી પેટા કાયદાની કલમ ૪૨ પ્રમાણે થાપણો અને કરજ ઉપરનુ વ્યાજ તથા ખર્ચ અને જોગવાઈઓ માટે રકમ રૂા. ૩૩,૬૪,૨૪,૮૨૨-૬૪ પૈસા બાદ જતાં વર્ષ આખરે રૂા.૩,૨૨,૧૧,૧૧૧-૦૦ પૈસાનો ચોખ્ખો નફો રહે છે. તેની નીચે પ્રમાણે ફાળવણી કરવા તથા ડિવિડન્ડ ૧૫ % પ્રમાણે ભરાયેલ શેરની રકમ ઉપર શેરહોલ્ડરને આપવા બેન્કનું કાર્યવાહક મંડળ ભલામણ કરે છે જે આપ સર્વે મંજૂર રાખશો એવી આશા છે.

અ. નં.	ફાળવણી	રૂા.	પૈસા
(૧)	સ્ટેચ્યુટરી રિઝર્વ ફંડ ખાતે લઈ જવા ૨૫ % મુજબ.....	રૂા.	૮૦,૫૨,૭૭૭-૭૫
(૨)	શકમંદ લેણા ફંડ ખાતે લઈ જવા ૧૫ % પ્રમાણે	રૂા.	૪૮,૩૧,૬૬૬-૬૫
(૩)	શેર હોલ્ડરોને ભરાયેલ રકમ ઉપર ૧૫ % પ્રમાણે ડિવિડન્ડ.....	રૂા.	૧,૬૬,૫૩,૮૭૮-૦૦
(૪)	શિક્ષણ ફાળો	રૂા.	૨,૦૦,૦૦૦-૦૦
(૫)	ઈન્વેસમેન્ટ ફલ્યુએશન ફંડ ખાતે	રૂા.	૧૦,૦૦,૦૦૦-૦૦
(૬)	બીલ્ડીંગ ફંડ ખાતે.....	રૂા.	૪,૭૨,૭૮૮-૬૦
(૭)	સાઈબર સેલ પ્રોવિઝન ફંડ ખાતે	રૂા.	૧૦,૦૦,૦૦૦-૦૦
	કુલ નફો	રૂા.	૩,૨૨,૧૧,૧૧૧-૦૦



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

તા. ૩૧-૩-૨૦૨૩ ના રોજનું

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	ભંડોળ તથા દેવું	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૧૨,૦૦,૦૦,૦૦૦-૦૦	૧. શેર ભંડોળ (૧) અધિકૃત શેર ભંડોળ ૪૮,૦૦,૦૦૦ શેર દરેક રૂ. ૨૫/- નો	૧૨,૦૦,૦૦,૦૦૦-૦૦	
૧૧,૧૭,૪૫,૩૫૦-૦૦	(૨) વસુલ આવેલ શેર ભંડોળ ૪૭,૩૨,૫૮૮ શેર દરેક રૂ. ૨૫/- નો ગઈ સાલ રૂ. ૪૪,૬૯,૮૧૪-૦૦ શેર જે પૈકી (અ) વ્યક્તિઓ (બ) સહકારી સંસ્થાઓ (ક) રાજ્ય સરકાર	૧૧,૮૩,૧૪,૯૫૦-૦૦	૧૧,૮૩,૧૪,૯૫૦-૦૦
૭,૫૩,૯૪,૪૪૯-૩૩	૨. રિઝર્વ ફંડ અને બીજા ફંડો ૧. સ્ટેચ્યુટરી રિઝર્વ	૮,૩૫,૫૯,૨૯૦-૨૫	
૫૩,૪૯,૫૦૫-૧૦	૨. ડિવિન્ડ ઇકવીલાઈઝેશન ફંડ	૫૬,૪૯,૫૦૫-૧૦	
૩,૦૧,૬૬,૩૪૦-૪૯	૩. બિલ્ડીંગ ફંડ	૩,૦૬,૬૬,૩૪૦-૪૯	
૬,૩૪,૭૭,૨૮૩-૩૭	૪. ઘસારા ફંડ	૬,૭૯,૫૭,૯૦૫-૩૭	
૩,૪૯,૭૦૮-૮૦	૫. ધર્માદા ફંડ	૩,૪૯,૭૦૮-૮૦	
૪૯,૨૬,૯૫૦-૦૭	૬. જનરલ અનામત ફંડ	૪૯,૨૬,૯૫૦-૦૭	
૧,૭૯,૮૮,૪૨૯-૫૯	૭. બિલ્ડીંગ રીવેલ્યુએશન રીઝર્વ	૧,૭૦,૮૯,૦૦૮-૫૯	
૬૧,૭૯,૯૪૫-૦૬	૮. મેમ્બર વેલ્ફેર ફંડ	૭૩,૯૯,૮૩૨-૦૮	
૮૦,૩૬,૫૩૭-૨૨	૯. કન્ટીજન્સી ફંડ	૧,૨૦,૩૬,૫૩૭-૨૨	
૭૩,૩૭૯-૦૦	૧૦. એજ્યુકેશન ફંડ	૭૩,૩૭૯-૦૦	
૨,૭૩,૫૫,૪૦૭-૮૧	૧૧. ખોટો અને શકમંદ લેણા રિઝર્વ	૩,૧૮,૫૭,૦૭૪-૫૮	
૪,૨૨,૦૫,૭૯૧-૩૨	૧૨. એન.પી.એ. રિઝર્વ ફંડ	૪,૩૨,૦૫,૭૯૧-૩૨	
૯૨,૨૬,૬૯૩-૨૪	૧૩. એન.પી.એ. વ્યાજ રિઝર્વ	૧,૨૩,૫૫,૨૮૩-૧૯	
૧,૨૪,૪૪,૦૯૬-૦૦	૧૪. કન્ટી. પ્રોવિ. અગે. સ્ટા. એસેટ્સ	૧,૪૪,૪૪,૦૯૬-૦૦	
૬,૪૦,૦૦૦-૦૦	૧૫. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીસીએશન રિઝર્વ એમ.ડી.સી.સી.	---	
૧,૧૫,૬૫,૦૦૦-૦૦	૧૬. ઈન્વેસ્ટમેન્ટ ઘસારા ફંડ ગર્વમેન્ટ સીક્યું	૧,૬૯,૬૫,૦૦૦-૦૦	
૨,૫૦૦-૦૦	૧૭. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીસીએશન ફંડ (જી.ડી.સી.સી. શેર સુચિત)	૨,૫૦૦-૦૦	
૩૦,૬૧,૬૬૮-૦૮	૧૮. મેમ્બર ગ્રીફટ ફંડ	૫૭,૫૪,૬૩૦-૦૮	
૨૫,૯૪,૩૪૬-૦૦	૧૯ કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી ડેવલોપમેન્ટ ફંડ	૪૫,૯૪,૩૪૬-૦૦	
૩૦,૦૦,૦૦૦-૦૦	૨૦ રીનોવેશન ફંડ	૫૦,૦૦,૦૦૦-૦૦	
૧૦,૦૦,૦૦૦-૦૦	૨૧ સાઈબર સેલ પ્રોવિઝન	૧૬,૫૪,૭૯૨-૦૦	
---	૩. મુખ્ય ગોણ રાજ્ય ભાગીદારી નિધિ		૩૬,૫૫,૪૧,૯૭૦-૧૪
	૪. ચાપણો અને અન્ય ખાતા		---
	(૧) બાંધી મુદતની ચાપણો		
૨૦૩,૧૪,૯૫,૩૭૦-૪૯	(અ) વ્યક્તિઓ	૨૦૮,૧૫,૭૮,૬૬૯-૪૯	
	(બ) મધ્યસ્થ સહકારી બેન્કો		
	(ક) બીજા મંડળીઓ		
૨૪૬,૮૨,૭૮,૭૫૦-૯૭	(આગળ ખેચ્યા)	૨૦૮,૧૫,૭૮,૬૬૯-૪૯	૪૮,૩૮,૫૬,૯૨૦-૧૪



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)

પાકું સરવૈયું

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	મિલ્કત તથા લેણું	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૬,૬૬,૭૯,૫૧૮-૦૦	૧. રોકડ હાથ ઉપર સિલક		૫,૮૭,૬૨,૯૫૩-૦૦
૨૩,૨૮,૧૭,૦૦૬-૦૪	૨. બીજી બેન્કમાં સિલક ચાલુ ખાતામાં	૧૭,૩૦,૯૫,૦૦૩-૫૪	
૪૦,૧૨,૦૦,૦૦૦-૦૦	બાંધી મુદત ખાતામાં	૪૩,૪૫,૦૦,૦૦૦-૦૦	૬૦,૭૫,૯૫,૦૦૩-૫૪
૧૦૮,૨૨,૬૦,૨૭૦-૦૦	૩. કોલ અને ટુંકી મુદતના નાણાં ૪. રોકાણો	૧૧૩,૯૭,૩૧,૮૩૦-૦૦	
૬,૪૭,૫૦૦-૦૦	(૧) મધ્યસ્થ અને રાજ્ય સરકારની જામીનગીરીઓમાં (ખરીદ કિંમત) (Book Value) બજાર કિંમત (Market Value) ૯૭,૮૩,૫૯,૧૩૫-૦૦ દર્શનીય કિંમત (Face Value) ૧૧૪,૫૦,૦૦,૦૦૦-૦૦ (૨) બીજી ટ્રસ્ટી જામીનગીરીઓમાં SLR બોન્ડ ખરીદ કિંમત - દર્શનીય કિંમત - (૩) સહકારી સંસ્થાઓમાં શેરમાં બીજા રોકાણો વિગતો આપવી. (૪) અન્ય રોકાણો (Non SLR Mutual Fund)	૬,૪૭,૫૦૦-૦૦	૧૧૪,૦૩,૭૯,૩૩૦-૦૦
૫૩,૬૫,૫૫,૩૯૧-૦૧	૫. મુખ્ય ગોણ રાજ્યો ભાગીદારી નિધિ રોકાણો ૬. ધિરાણ ટુંકી મુદતની લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને બિલ્સ ડિસ્કાઉન્ટસ પૈકી અવેજવાળું (અ) સરકારી અને બીજી માન્ય જામીનગીરીઓ સામે (બ) બીજી ટેન્જબલ જામીનગીરીઓ સામે રૂ. ૫૯,૧૧,૪૦,૧૬૮-૯૭	૫૯,૧૧,૪૦,૧૬૮-૯૭	
૨૩૨,૦૧,૫૯,૬૮૫-૦૫	(આગળ ખેંચ્યા)	૫૯,૧૧,૪૦,૧૬૮-૯૭	૧૮૦, ૬૭,૩૭,૨૮૬-૫૪



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

તા. ૩૧-૩-૨૦૨૩ ના રોજનું

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	બંડોળ તથા દેવું	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૨૪૬,૮૨,૭૮,૭૫૦-૯૭	પાછળનો સરવાળો	૨૦૮,૧૫,૭૮,૬૬૯-૪૯	૪૮,૩૮,૫૬,૯૨૦-૧૪
૧૨૪,૭૭,૬૧,૩૫૧-૬૩	૨. સેવિંગ્સ બેન્કમાં થાપણો		
---	(અ) વ્યક્તિઓ	૧૩૩,૨૭,૩૦,૨૮૦-૧૦	
---	(બ) મધ્યસ્થ સહ. બેન્કો	---	
---	(ક) બીજી મંડળીઓ	---	
૨૩,૪૫,૭૯,૮૦૫-૩૭	૩. ચાલુ થાપણો		
---	(અ) વ્યક્તિઓ	૨૩,૭૨,૬૦,૦૬૭-૪૪	
---	(બ) મધ્યસ્થ સહ. બેન્કો	---	
---	(ક) બીજી મંડળીઓ	---	૩૬૫,૧૫,૬૯,૦૧૭-૦૩
---	૪. કોલ અને ટુંકી મુદતના નાણાં		---
---	૫. કરજ		
---	(૧) સીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા		
---	મહેસાણા ડીસ્ટ્રીક્ટ, સેન્ટ્રલ કો.ઓ.બેન્કમાંથી	---	
---	(અ) ટુંકી મુદતની લોન રોકડ શાખ અને		
---	ઓવર ડ્રાફ્ટ પૈકી	---	
---	૧. સરકારી અને અન્ય જામીનગીરી સામે તારણ	---	
---	૨. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે	---	
---	(બ) મધ્યમ મુદતની લોન	---	
---	(ક) લાંબી મુદતની લોન	---	
---	(૨) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી	---	
---	(૩) રાજ્ય સરકાર તરફથી	---	
---	(૪) અન્ય રીતે મેળવેલ લોન F.D. લોન	---	
૨૫,૦૦૦-૦૦	૬. બિલ્સ ફોર કલેક્શન બીઇંગ બિલ્સ રીસીવેબલ		
---	સામે બાજુએ જણાવ્યા મુજબ		૧૦,૦૦૦-૦૦
---	૭. બાન્ય એડજસ્ટમેન્ટ		---
૧૩,૪૫,૬૬,૬૧૫-૦૦	૮. મુદત વિતેલ વ્યાજ		૧૪,૦૨,૦૫,૪૬૯-૦૦
---	૯. વ્યાજ આપવાનાં બાકી		
૧,૦૨,૨૭,૫૬૪-૦૦	(અ) મેચ્યોર્ડ ફીક્સ ડીપોઝીટ વ્યાજ	૭૯,૫૧,૯૯૫-૦૦	
૧૩,૮૦,૦૩,૫૯૬-૦૦	(બ) આપવાપાત્ર એફ.ડી. વ્યાજ	૧૦,૯૪,૬૧,૯૪૫-૦૦	
૨,૯૫,૩૦૦-૦૦	(ક) રીકરીંગ ડીપોઝીટ વ્યાજ	૨,૮૮,૫૩૦-૦૦	
૫,૦૦,૦૦૦-૦૦	(ડ) સેવિંગ્સ ડીપોઝીટ વ્યાજ	૬,૦૦,૦૦૦-૦૦	૧૧,૮૩,૦૨,૪૭૦-૦૦
૪૨૩,૪૨,૩૭,૯૮૨-૯૭	(આગળ ખેંચ્યા)		૪૩૯,૩૯,૪૩,૮૭૬-૧૭



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

તા. ૩૧-૩-૨૦૨૩ ના રોજનું

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	ભંડોળ તથા દેવું	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૪૨૩,૪૨,૩૭,૯૮૨-૯૭	પાછળનો સરવાળો		૪૩૯,૩૯,૪૩,૮૭૬-૧૭
૬૭,૮૯,૬૮૬-૦૨	૧૦. અન્ય જવાબદારીઓ	૨,૯૭,૯૦,૩૬૪-૦૨	
૪,૮૪,૭૩૮-૦૦	૧. પરચુરણ જવાબદારી	૬,૧૯,૦૧૮-૦૦	
૭,૭૯,૫૦૬-૦૦	૨. પી.એફ.કોન્ટ્રી.ઈન્કયુ	૨૦,૨૯,૩૬૭-૦૦	
૫-૦૦	૩. શેર અરજી ખાતું	૩૫-૦૦	
—	૪. નોમીનલ	—	
૬-૫૭	૫. કલીયરીંગ હાઉસ ઓ.પેએ.	—	
—	૬. CGST પેએબલ	૧૬,૧૫૯-૫૧	
—	૭. SGST પેએબલ	૧૬,૧૪૧-૫૧	
—	૮. પરચુરણ ખર્ચ (સન્ડ્રી ડીપોઝીટ)	—	
—	૯. કેશ એકસેસ	—	
—	૧૦. સ્ટાફ બોનસ (એક્સગ્રેસીયા સાથે)	—	
—	૧૧. સ્ટાફ વ્યવસાય વેરો	—	
૯૭,૮૧૩-૦૦	૧૨. એલ.આઈ.સી. પેએબલ સ્ટાફ	—	
—	૧૩. ઈન્કમ ટેક્સ એડવાન્સ	૬૦,૦૦,૦૦૦-૦૦	
૩૫,૩૭૬-૦૦	૧૪. કેશ ઓન TDS	૯૨,૪૧૩-૦૦	
૧,૮૭,૬૪૨-૧૩	૧૫. સન્ડ્રી પેએબલ	૨,૧૧,૬૪૨-૧૩	
૨,૦૦,૦૦૦-૦૦	૧૬. લાઈટ બીલ અને ટેલીફોન બીલ પ્રોવિઝન	૨,૫૦,૦૦૦-૦૦	
૨,૨૦,૦૦૦-૦૦	૧૭. આપવા પાત્ર ઓડીટ ફી	૩,૦૦,૦૦૦-૦૦	
—	૧૮ સન્ડ્રી અનામત	—	
૧૮,૬૮,૯૮૦-૦૦	૧૯. ડીવિન્ડડ આપવાનું બાકી	૨૧,૯૧,૯૬૩-૦૦	
૧,૦૮,૦૦૦-૦૦	૨૦. સબસિડી પેએબલ	૩૬,૦૦૦-૦૦	
૨૧,૩૭,૦૦૫-૦૦	૨૧. સ્ટાફ લીવ પ્રોવિઝન	—	
૧,૧૪,૨૫૩-૦૦	૨૨. ફિક્સ ડીપોઝીટ પેએબલ	૩,૨૨,૪૯૦-૦૦	
૪૩,૧૫૬-૩૩	૨૩. સર્વિસ ટેક્સ	—	
—	૨૪. મેમ્બર ગીફ્ટ ફંડ	—	
૪૦,૦૦,૦૦૦-૦૦	૨૫. સ્ટાફ પી.એલ.એન્ડ એસ.એલ. લીવ પ્રોવિઝન	૮૦,૦૦,૦૦૦-૦૦	૪,૯૮,૭૫,૫૯૩,-૧૭
	૧૧. નફા ભંડોળ		
૨,૫૧,૯૮,૫૬૯-૫૭	માછળ સરવૈયા મુજબ નફો	૩,૦૦,૧૧,૧૧૧-૬૯	
૨,૫૧,૯૮,૫૬૯-૫૭	બાકી - વહેંચણી	૩,૦૦,૧૧,૧૧૧-૬૯	
	બેલેન્સ		
૩,૦૦,૧૧,૧૧૧-૬૯	ઉમેરો : ચાલુ સાલનો નફો	૩,૨૨,૧૧,૧૧૧-૦૦	૩,૨૨,૧૧,૧૧૧-૦૦
	❖ આકસ્મિક જવાબદારીઓ :		
	(૯) આપવામાં આવેલી ગેરંટી અંગેની બાકી રહેતી જવાબદારીઓ		
	ગઈ સાલ રૂ. ---		
	ચાલુ સાલ રૂ. ---		
	(બ) અન્ય		
	{ DEAF માં		
	{ ટ્રાન્સફર કરેલ રકમનું વર્ષ અંતે		
	{ બેલેન્સ રૂ. ૨,૦૪,૮૦,૩૯૬-૪૦ }		
૪૨૮,૧૩,૧૫,૨૬૧-૭૧	કુલ		૪૪૭,૬૦,૩૦,૫૮૦-૩૪

ઓડીટર્સ : આર. એસ. પટેલ એન્ડ કું.
ફર્મ રજી. નં. ૧૦૭૭૫૮W
C.A. રાજન બી. શાહ (પાર્ટનર)
મેમ્બર શીપ પેનલ નં. ૧૦૧૯૯૮

તા. ૦૩-૦૬-૨૦૨૩



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

પાકું સરખેયું

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	મિલકત તથા લેણું	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૩૮૮,૮૦,૬૮,૧૬૧-૬૮	પાછળનો સરવાળો (બ) બીજી ટેકજીનલ જામીનગીરીઓ સામે રૂ. ૧૭૩,૮૩,૩૫,૨૫૮-૮૧ ઉપરના ધીરાણ પૈકી વ્યક્તિઓ પાસે લેણું રૂ. ૧૭૩,૮૩,૩૫,૨૫૮-૮૧ ઉપરના ધીરાણ પૈકી મુદત વીતી બાકી રૂ. ૧,૮૦,૨૭,૫૧૧-૩૪ વસુલાત માટે ખોટ અને શકમંદ ગણાય તેવું રૂ.	૨૩૫,૭૭,૩૨,૩૩૨-૦૨	૧૮૦, ૬૭,૩૭,૨૮૬-૫૪
૧,૭૪,૧૧,૮૭૮-૦૦	૭. મળવા પાત્ર વ્યાજ (અ) રોકાણો ઉપર (બ) રોકાણો ઉપર (Non S.L.R.) (ક) શકમંદ લેણા ઉપર	૧,૮૩,૮૧,૦૧૯-૦૦ ૧,૮૬,૪૮,૫૮૩-૦૦ ૧૪,૦૨,૦૫,૪૬૮-૦૦	૨૩૫,૭૩,૩૨,૩૩૨-૦૨
૨૫,૦૦૦-૦૦	૮. ગિલ્ડ રીસીવેબલ બીઈંગ બીલ્સ ફોર કલેક્શન સામી બાજુ જણાવ્યા મુજબ		૧૭,૮૨,૩૬,૦૮૧-૦૦
---	૯. ગ્રાન્યોના એડજસ્ટમેન્ટ		૧૦,૦૦૦-૦૦
૨૦,૮૧,૮૦૫-૦૦	૧૦. સ્થાયર મિલકત જમીન ખરીદી (અ) જમીન ખરીદી (બ) મકાન	૨૦,૮૧,૮૦૫-૦૦ ૪,૭૨,૮૦,૧૫૫-૨૮	---
૩,૮૮,૮૩,૨૮૧-૨૪	૧૧. ફર્નિચર અને ફીકચર્સ (૧) સેઈફ ડીપોઝીટ વોલ્ટ (૨) ફર્નિચર અને સરજામ (૩) કોમ્પ્યુટર (૪) મોટર કાર (૫) સોલર પેનલ	૧,૬૮,૪૧,૮૦૬-૦૩ ૨,૬૦,૨૧,૧૬૪-૩૭ ૧,૬૧,૪૪,૮૮૫-૫૬ ૪૭,૮૮,૭૨૩-૦૦ ૫,૧૨,૨૮૮-૬૦	૪,૮૩,૭૨,૦૬૦-૨૮
૧,૬૫,૪૨,૨૨૮-૦૩	૧૨. બીજી મિલકતો ૧. ટેલિફોન ડીપોઝીટ ૨. સ્ટેશનરી અને પ્રિન્ટીંગ સ્ટોક ૩. બેંક રીવોલ્વર ૪. અધેશીવ સ્ટેમ્પ ૫. સ્ટેમ્પ અને ફેન્કીંગ ૬. જી.ઈ.બી. ડીપોઝીટ ૭. TDS રીસીવેબલ ૮. CGST Recd ૯. IGST Recd ૧૦. SGST Recd ૧૧ અનામત ઉધાર ૧૨. SGST Payable ૧૩ વાડજ શાખા એડવાન્સ ભાડુ ૧૪. Deaf Claim Receivable A/C ૧૫. EX. GRATIA Receivable GL ૧૬. Deaf Payable A/C ૧૭. C- Key Fee ૧૮. Cersai Fee	૨,૨૮,૦૫,૨૪૧-૦૫ ૧,૪૦,૪૫,૨૬૮-૮૪ ૧૮,૩૮,૬૨૦-૦૦ ૮૨,૫૫૮-૦૦ ૨,૧૬,૮૧૧-૦૦ ૧,૧૩,૮૫૩-૫૦ ---	૬,૪૩,૧૮,૮૭૮-૫૬
૨૮,૮૩,૭૫૫-૦૦	૧૩. નોન બેકીંગ એસેટ્સ	૫૮,૫૫૮-૦૦ ૩,૪૮,૨૪૮-૦૦ ૧,૧૩,૮૫૩-૫૦ ---	---
૨,૬૦,૮૨૧-૦૦	૧૪. નફા ગુકશાન	૧,૪૧,૧૫,૦૧૦-૦૦ ૨,૦૨,૮૮૮-૦૦ ---	---
૧૪,૪૦૦-૦૦	કુલ	૧૫,૮૩,૪૩૮-૮૫ ૧૩,૩૨,૬૭૮-૮૩ ૧૬,૮૮,૮૬૭-૮૫ ---	---
૧૨,૭૬,૦૭૩-૧૪		૮૦,૦૦૦-૦૦ ૨૫,૭૫૧-૦૦ ---	---
૫,૭૪,૧૦૫-૦૦		૬૮,૨૨૫-૮૦ ૪,૨૧૦-૦૦	---
૧૩,૮૧,૫૦૨-૧૪		(૨,૦૪,૮૦,૩૮૬-૪૦)	---
૪૪,૭૧,૦૫૬-૬૫		૪૮,૨૨૫-૮૦ ૪,૨૧૦-૦૦	---
૧૧-૪૩			---
૮૦,૦૦૦-૦૦			---
૨૮,૬૪૨-૮૧			---
---			---
(૧,૭૮,૧૮,૨૮૭-૮૩)			---
---			---
---			---
---			---
૪૨૮,૧૩,૧૫,૨૬૧-૭૧			૪૪૭,૬૦,૩૦,૫૮૦-૩૪

ડીરેક્ટર્સ :-	(૭) શ્રી ઘવલકુમાર શૈલેષભાઈ પટેલ (૮) શ્રી ગણપતભાઈ અંબાલાલ પટેલ (૯) શ્રી જયેશકુમાર નટવરલાલ પટેલ (૧૦) શ્રી નિલેશકુમાર ગુણવંતલાલ પટેલ (૧૧) શ્રી પ્રમોદભાઈ કાન્તિલાલ પટેલ (૧૨) શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહ (૧૩) શ્રી જીગ્નેશકુમાર શૈલેષભાઈ પટેલ	(૧) શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ - ચેરપર્સનશ્રી (૨) શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ - વાઈસ ચેરમેનશ્રી (૩) શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ (C.A.) - મેનેજીંગ ડિરેક્ટરશ્રી (૪) શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ - જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટરશ્રી (૫) શ્રી પરેશભાઈ આર. જોષી - જનરલ મેનેજરશ્રી
(૧) શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ (૨) શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ (૩) શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ (C.A.) (૪) શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ (૫) શ્રી ચિરાગકુમાર ગોવિંદભાઈ પટેલ (૬) શ્રી દીપકકુમાર વિઠ્ઠલદાસ પટેલ		



ઘી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ(ઉ.ગુ.)

પુરા થતા વર્ષનું નફા નુકશાન ખાતુ

તા. ૩૧-૩-૨૦૨૨ રૂ. પૈસા	આવક	રૂ. પૈસા	તા. ૩૧-૩-૨૦૨૩ રૂ. પૈસા
૩૩,૩૩,૮૯,૩૯૭-૨૫	૧. વ્યાજ અને વળતર		૩૬,૧૦,૬૦,૪૯૩-૧૮
૨,૯૦,૫૬૬-૪૦	૨. કમીશન વટાવ અને દલાલી		૩,૩૮,૦૩૩-૫૦
---	૩. સબસીડી અને ડોનેશન		---
---	૪. બિનબેંકીંગ મિલકતમાંથી આથવા એવી મિલકતના વેચાણ કે હેરફેર થી થયેલ આવક		---
---	૫. બીજી આવક		
---	(૧)લોકર્સ ભાડા આવક	૧૮,૬૩,૮૫૬-૦૦	
---	(૨)કેન્ડીડેટ ફોર્મ ફી	૨૨,૦૦૦-૦૦	
---	(૩)વ્હીકલ ચાર્જસ	---	
૨,૩૫,૨૮૫-૫૦	(૪) ચેક બુક ચાર્જ	૨,૩૮,૫૮૯-૫૪	
૬,૯૨,૭૫૮-૫૯	(૫) ઈન્સીડેન્ટલ ચાર્જસ	૫,૯૬,૩૯૪-૭૩	
૭૭,૫૫૦-૦૦	(૬) શેર ડીવીડન્ડ	૯૬,૭૫૦-૦૦	
૫૮,૭૦૮-૧૯	(૭)અન્ય (પરચુરણ) આવક	૧,૨૩,૦૮૫-૦૦	
૩૨,૭૩૮-૦૦	(૮) કેશ હેન્ડલીંગ ચાર્જસ	૬,૬૬૦-૦૦	
---	(૯) ઈન્વેસ્ટમેન્ટ ઘસારા ફંડ ગર્વમેન્ટ સિક્યુરીટીમાંથી લાવ્યા	---	
૯,૧૫,૦૦૦-૦૦	(૧૦) સ્ટેમ્પ ફેન્કીંગ	૧૨,૨૦,૦૦૦-૦૦	
---	(૧૧) મેચ્યોર્ડ ફીક્સ ડીપોઝીટ વ્યાજ	---	
૨૨,૨૦૦-૦૦	(૧૨) એ.ટી.એમ. કાર્ડ	૧૮,૯૫૦-૦૦	
૯૫,૦૦૦-૦૦	(૧૩) સીકાચાર્જ	૯૫,૪૦૦-૦૦	
---	(૧૪) નોન એસ.એલ.આર.મ્યુ.ફંડ	---	
૮,૭૧,૦૮૦-૦૦	(૧૫) Interest Received on Call Momey	૨૪,૨૨૦-૦૦	
---	(૧૬) Interest Payable On Matured FD	૨૨,૭૫,૫૬૯-૦૦	
૪,૬૧૭-૫૬	(૧૭) NPCI - NACH - ACH Income	૧૫,૫૩૪-૬૯	
૩૩૧-૦૦	(૧૮) શેર દાખલ ફી	૪૯૮-૦૦	
---	(૧૯) SELL Of Government Security	---	
	(૨૦) ઈન્વેસ્ટમેન્ટ	૬,૪૦,૦૦૦-૦૦	૭૨,૩૭,૫૦૬-૯૬
૩૩,૬૬,૮૫,૨૩૨-૪૯	કુલ		૩૬,૮૬,૩૬,૦૩૩-૬૪

ડિરેક્ટર્સ :-

- (૧) શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ
- (૨) શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ
- (૩) શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ (C.A.)
- (૪) શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ
- (૫) શ્રી ચિરાગકુમાર ગોવિંદભાઈ પટેલ
- (૬) શ્રી દીપકકુમાર વિહલદાસ પટેલ

- (૭) શ્રી ઘવલકુમાર શૈલેષભાઈ પટેલ
- (૮) શ્રી ગણપતભાઈ અંબાલાલ પટેલ
- (૯) શ્રી જયેશકુમાર નટવરલાલ પટેલ
- (૧૦)શ્રી નિલેશકુમાર ગુણવંતલાલ પટેલ
- (૧૧)શ્રી પ્રમોદભાઈ કાન્તિલાલ પટેલ
- (૧૨)શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહ
- (૧૩)શ્રી જીગ્નેશકુમાર શૈલેષભાઈ પટેલ

- (૧) શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ - ચેરપર્સનશ્રી
- (૨) શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ - વાઈસ ચેરમેનશ્રી
- (૩) શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ (C.A.) - મેનેજીંગ ડિરેક્ટરશ્રી
- (૪) શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ - જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટરશ્રી
- (૫) શ્રી પરેશભાઈ આર. જોષી - જનરલ મેનેજરશ્રી



Independent Statutory Auditor's Report for the Year Ended 31st March 2023

To,
The Members,
The Kalol Nagarik Sahakari Bank Limited

Report on the Audit of Financial Statements:

Qualified Report

We have audited the accompanying financial statements of The Kalol Nagarik Sahakari Bank Limited, Kalol which comprise the Balance Sheet as at March 31, 2023, Profit and Loss Account and Cash Flow Statement for the year ended on March 31, 2023, and a summary of significant accounting policies and other explanatory information. We have conducted audit of **Six** branches and head office of the bank.

In our opinion and to the best of our information and according to the explanations given to us, except for the possible effects of the matter described in the Basis for qualified opinion paragraph, the aforesaid standalone financial statements give the information required by the Banking Regulation Act, 1949 and the guidelines issued by the Reserve Bank of India (RBI), in the manner so required for bank and are in conformity with accounting principles generally accepted in India and:

- a. the Balance Sheet, read with the notes thereon is a full and fair Balance Sheet containing all the necessary particulars, is properly drawn up so as to exhibit a true and fair view of the state of affairs of the Bank as at 31st March, 2023;
- b. the Profit and Loss Account, read with the notes thereon shows a true balance of profit and
- c. the Cash Flow Statement gives a true and fair view of the cash flows for the year ended on that date.

Basis of Qualified Opinion

Contribution made towards gratuity fund is debited as expense in Profit & Loss account, however provision for gratuity as per actuarial valuation as required by Accounting Standard 15 "Employee Benefits" is not done by the bank. In absence of information we are not in a position to quantify the exact impact of the same.

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) issued by the Institute of Chartered Accountants of India. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Bank in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Banking



Regulation Act, 1949 and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the code of ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our qualified opinion.

Emphasis of Matter

Information Other than the Financial Statement and Auditor's Report thereon.

The Bank's Board of Directors is responsible for the preparation of the other information. The other information comprise the information included in the Report of Board of Directors including other explanatory information, but does not include the financial statements and our auditor's report thereon.

Our opinion on the financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

When we read the Report of Board of Directors including other explanatory information, if we conclude that there is a material misstatement therein, we are required to communicate the matter to those charged with governance and the members in the Annual General Meeting.

Management's Responsibility for the Financial Statements:

The Bank's Board of Directors is responsible for preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards issued by ICAI, provisions of Banking Regulation Act, 1949, Registrar of Cooperative Societies, the Gujarat Co-operative Societies Act-1961, the Gujarat Co-Operative Societies Rules,1965, (as applicable) and the rules made thereunder, and circulars and guidelines issued by (RBI) from time to time and the accounting standard issued by ICAI. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial



controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Bank's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the bank or to cease operations, or has no realistic alternative but to do so. The Board of Directors are responsible for overseeing Bank's Financial Reporting progress.

Auditor's Responsibility:

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with Standard on Auditing will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with Standard on Auditing, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the bank's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to



the date of our auditor's report. However, future events or conditions may cause the bank to cease the Bank to continue as a going concern.

- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

Materiality is the magnitude of the misstatements in the standalone financial statements that, individually or aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the financial statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i) planning of the scope of our audit work and evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatement in the financial statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements:

The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms A and B respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949.

Subject to the limitations of the audit indicated in Auditor's responsibility as above and subject to the limitations of disclosure required therein, we report that:

1. We have obtained all the information and explanations which, to the best of our knowledge and belief, were necessary for the purposes of our audit and have found them to be satisfactory;
2. To the best our information and explanations given to us, the transaction of the Bank, which have come to our notice have been within the power of the Bank.



3. In our opinion, proper books of account as required by law have been kept by the bank so far as it appears from our examination of those books.
4. The reports on the accounts of the branches audited by us have been properly dealt with by us in preparing this report.
5. The Balance sheet, the Profit and Loss Account and the Cash Flow Statement dealt with by this report, are in agreement with the books of account maintained by the Bank.
6. In our opinion, the Balance Sheet, the Profit and Loss Account and Cash Flow Statement comply with the applicable accounting standards, to the extent they are not inconsistent with the accounting policies prescribed by RBI except as stated in our basis for qualified opinion.

For, R. S. Patel & Co.

CHARTERED ACCOUNTANTS

Firm Reg. No.: 107758W

Date: 03/06/2023

Place: Ahmedabad

Rajan B. Shah

Partner

Membership No.: 101998

UDIN - 23101998BGWDZS3889



THE KALOL NAGRIK SAHAKARI BANK LTD., KALOL

Details regarding disclosure norms prescribed for UCBs
NOTES FORMING PART OF ACCOUNTS FOR THE YEAR ENDED ON 31st MARCH 2023
SIGNIFICANT ACCOUNTING POLICIES & NOTES TO ACCOUNTS

A. **Significant Accounting Policies**

ACCOUNTING CONVENTION:

The financial statements are prepared by following the going concern concept on historical basis unless otherwise stated and confirm to statutory provisions and practices prevailing in India.

USE OF ESTIMATES:

The preparation of financial statements requires the management to make estimates and assumptions considered in the reported amount of assets and liabilities as of the date of the financial statements and the reported income and expenses during the reporting period. Although these estimates are based upon the management's best knowledge of current action and events, actual results could differ from these estimates.

ADVANCES:

- A. As per guidelines issued by the RBI, the advances to the borrowers are classified into performing and non performing assets based on the recovery of the amount of principle and the interest and further the Non performing assets are classified into the sub standard, Doubtful and the loss assets. The bank has made the necessary provision in respect of the standard, Sub standard, doubtful and Loss assets as per the RBI.
- B. The overdue interest in respect of advances is provided separately under overdue interest reserve as per the directives issued by the RBI.



FIXED ASSETS AND DEPRECIATION:

- A. Fixed assets are stated at their historical costs/revaluation less accumulated depreciation. Depreciation for each year has been accumulated and credited to Depreciation Reserve Fund. Costs include incidental expenses incurred on acquisition of assets.
- B. Premises and other fixed assets (including land where the cost of the land is not segregated) are depreciated on the WDV Method except computer at the following rates.

Sr.No.	Assets	Rate
1.	Building	5%
2.	Furniture	10%
3.	Vehicle	15%
4.	Computer	33.33%
5.	Locker & Door	10%

- C. As per RBI circular, depreciation on computer & software is required to be provided on Straight Line Method as 33.33%. The cost of the computer & software is required to be written off over three years in equal proportion. Bank has also charge depreciation on computer & software @ 33.33% on Straight Line Method.
- D. Depreciation on fixed assets purchased during the year is charges for the period of use of assets during the year. No depreciation is charged on fixed assets sold during the year.

IMPAIRMENT OF ASSETS :

A substantial portion of the bank's assets comprise of 'financial assets' to which Accounting standard 28 "Impairment of assets" is not applicable In respect of assets to which Standard applies, in the opinion of the management, there are no indication, internal or external which could have the effect of impairing the value of the assets to any material extent as at 31st March 2022 requiring recognition in terms of said standard.



INVESTMENTS:

- a. The entire investment portfolio of the bank is classified in accordance with the RBI guideline, into three categories.
 1. Held to maturity comprising of investment acquired with the intention to hold them till maturity.
 2. Held to trading comprising of investment acquired with the intention to trade.
 3. Available for sale comprising of investment, which are not classified as per above two categories. However, the bank does not have any investment otherwise than held to maturity.
- b. Investment are further classified as:
 1. Central and state government securities
 2. Shares of co-operative banks
 3. FDR's
 4. Other approved securities
- c. Investments classified as held to maturity are carried at acquisition cost unless it is more than face value, in which case the premium is amortized over the period remaining to maturity.
- d. Investment classified as held for trading and available for sale are marked to marked script wise and the resultant depreciation is recognized in the profit and loss account. Net appreciation is ignored.
- e. Profit or loss on sale of investment held for trading and available for sale is taken to profit and loss account.
- f. Premium paid on purchase of investment held to maturity is amortized in equal proportion over the period of maturity of investment.

REVENUE RECOGNITION:

Income/Expenditure is accounted on accrual basis except the following which are accounted on cash basis.

- a. Interest and other income on non-performing assets are accounted on as per the RBI guidelines.
- b. Insurance premium.
- c. The bank has the policy to issue the locker against the interest free deposit.
- d. Interest Income and Interest Expenses includes the contra amount receivable and payable from or to the branches respectively.



EMPLOYEE BENEFITS:

- a. For the future liabilities of the Bank for the gratuity to the staff of Bank has tied up with the LIC.
- b. Bank had provided leave encashment provision.
- c. Provident fund contribution is remitted to recognized provident fund commissioner for the future benefit to the staff for provident Fund every month along with the staff contribution.

ACCOUNTING ON TAXES ON INCOME:

Current year tax is determined as the amount of tax payable in respect of taxable income for the year. Deferred tax on timing difference between the accounting income and the tax income that originates in one period and is capable of reversal in one or more subsequent period is not recognized in the Balance Sheet of current year.

CONTINGENCIES AND EVENTS OCCURRING AFTER THE BALANCE SHEET:

Material adjusting events (that provides evidence of condition that balance sheet) occurring after the balance sheet date are recognized in the financial statements. Non adjusting events (that are indicative of the conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance date represents material change and commitment affecting the financial position are disclosed in the report of the board of directors.

PROVISIONS, CONTINGENT LAIBILITIES AND CONTINGENT ASSETS:

In conformity with AS 29 "Provision, Contingent liabilities and contingent assets" issued by the ICAI, the bank recognize provision only when it has a present obligation as a result of past event, it is probable that an required to settle the obligation, and when a reliable estimate of the amount of the obligation can be made.



B. NOTES TO ACCOUNTS

1. FOREIGN EXCHANGE TRANSACTION

Bank has not entered any foreign currency transaction during the year.

2. REGROUPING OF PREVIOUS YEAR DATA

Previous year figures have been regrouped or rearranged whenever necessary to confirm to the presentation of the accounts of the current year. Figures are round off to the nearest rupee.

3. SEGMENT REPORTING

As per Accounting Standard 17 issued by The Institute of Chartered Accountant of India for the segment reporting the operation areas of bank is separated into segments, which is as follows.

1. Primary Segments Information:

a) Treasury: Dealing operations in money market Instruments

It includes all investment portfolio, profit/loss on sale of investments and money market operations. The expenses of this segment comprise of interest expenses on funds borrowed from external sources as well as internal sources and depreciation / amortization of premium on 'Held to Maturity' category investments.

b) Retail Banking

The Retail Banking Segment comprises of borrowers having exposure of less than Rs.5.00 Crores.

c) Corporate/ Wholesale Banking

The Corporate / Wholesale Banking segment comprises the lending activities of borrowers having exposure of Rs.5.00 Crores and above.

d) Other Banking Operations

Segments not classified under (a) to (c) above are classified under this primary segment.

2. Secondary Segment Information: Bank caters mainly to the needs Gujarat state customers; hence separate information regarding secondary segment i.e. Geographical Segment is not applicable.

3. Allocation of common cost: To the extent the cost can be directly identified they are allocated to related segment, other common cost are allocated on reasonable basis.

4. Unallocated Items: Unallocated items include general banking items which are not allocated to any business segment.



Part A: Business Segments

(Amount In Rs. Crores)

Particulars	Treasury		Corporate/ Wholesale Banking		Retail Banking		Other Banking Business		Total	
	Current	Previous	Current	Previous	Current	Previous	Current	Previous	Current	Previous
	Year	Year	Year	Year	Year	Year	Year	Year	Year	Year
Revenue	10.18	8.90	-	-	23.51	22.35	3.17	2.42	36.86	33.67
Result(Expense)	6.31	5.84	-	-	25.24	23.38	0	0	31.55	29.22
Unallocated expenses									0	0
Operating profit									5.32	4.45
Income taxes									2.09	1.45
Extraordinary profit/Loss	-	-	-	-	-	-	-	-	-	-
Net profit									3.22	3.00
Other information	-	-	-	-	-	-	-	-	-	-
Segment assets	196.74	185.35	-	-	294.84	286.00			491.78	471.35
Unallocated assets									0	0
Total assets									491.78	471.35
Segment liabilities	196.74	185.35	-	-	294.84	286.00	0	0	491.78	471.35
Unallocated liabilities									0	0
Total liabilities									491.78	471.35

Part B: Geographic Segments

(Amount In Rs. Crores)

	Domestic		International		Total	
	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
(a) Revenue	36.86	33.67	0	0	36.86	33.67
(b) Assets	491.78	471.35	0	0	491.78	402.85



4. Disclosure of various information as required by RBI circularno: DOR.ACC.REC. No.45/21.04.018/2021- 22 dated August 30, 2021 is as under:

1. Regulatory Capital

(a). Composition of Regulatory Capital

(Amount in Rs. crore)

Sr. No	Particulars	Current Year	Previous Year
i.	Paid up share capital and reserves (net of deductions, if any)	24.04	22.46
ii.	Other Tier 1 capital	0.00	0.00
iii.	Tier 1 capital (i + ii)	24.04	22.46
iv.	Tier 2 capital	3.82	4.08
v.	Total capital (Tier 1+Tier 2)	27.85	26.54
vi.	Total Risk Weighted Assets (RWAs)	243.83	225.89
vii.	Paid-up share capital and reserves as percentage of RWAs	9.86 %	9.94 %
viii.	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	9.86 %	9.94 %
ix.	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	1.57 %	1.81 %
x.	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	11.42 %	11.75 %

2. Asset liability management

(a). Maturity pattern of certain items of assets and liabilities. (31/03/2023)

(Amount in Rs. crore)

	1 To 14 days	15 To 28 days	29 Days To 3 months	Over 3 Months To 6 months	Over 6 Months To 1 Year	Over 1 Year To 3 years	Over 3 Year To 5 year	Over 5 years	Total
Deposits	24.62	7.07	28.94	42.74	94.05	165.15	0.28	2.30	365.16
Advances	2.56	1.95	18.80	23.54	50.18	63.52	42.00	33.22	235.77
Investment	5.00	0.00	4.90	17.45	23.99	1.50	0.00	104.58	157.42
Borrowing	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Foreign Currency Assets	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Foreign Currency Liabilities	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00



3. Investments

(a). Composition of Investment Portfolio as at 31-03-2023

(Amount in Rs. Crore)

	G-Securities	Other Approved Securities (T-Bill)	Shares	Others	Total
Held to Maturity					
Gross	83.55	-	0.06	-	83.61
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	83.55	-	0.06	-	83.61
Available for Sale					
Gross	21.04	9.39	-	-	30.43
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	21.04	9.39	-	-	30.43
Held for Trading					
Gross	-	-	-	-	-
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	-	-	-	-	-
Total Investments	104.58	9.39	0.06	-	114.03
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	104.58	9.39	0.06	-	114.03



As at 31-03-2022

(Amount in ₹ crore)

	G-Securities	Other Approved Securities (T-Bill)	Shares	Others	Total
Held to Maturity					
Gross	73.70	-	0.06	-	73.76
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	73.70	-	0.06	-	73.76
Available for Sale					
Gross	20.09	14.44	-	-	34.53
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	20.09	14.44	-	-	34.53
Held for Trading	-	-	-	-	-
Gross	-	-	-	-	-
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	-	-	-	-	-
Total Investments	93.79	14.44	0.06	-	108.29
Less Provision For Non-performing Investments (NPI	-	-	-	-	-
Net	93.79	14.44	0.06	-	108.29

1. The Bank has no investment in debentures, bonds, subsidiaries & joint ventures, therefore Bank has not given separate information here.
2. The Bank do not have any investment outside India, therefore Bank has not given separate information here.



(b). Movement of provisions for Depreciation and Investment Fluctuation Reserve

(Amount in ₹ crore)

Particulars	Current Year(2022-23)	Previous Year(2021-22)
I. Movement of provisions held towards depreciation on investments.		
a) Opening balance	0.71	0.56
b) Add: Provisions made during the year	0.50	0.15
c) Less: Write off / write back of excess provisions during the year		
d) Closing balance	1.21	0.71
II. Movement of Investment Fluctuation Reserve		
a) Opening balance	0.45	0.30
b) Add: Amount transferred during the year	0.04	0.15
c) Less: Drawdown		
d) Closing balance	0.49	0.45
III. Closing balance in IFR as a percentage of closing balance of investments in AFS and HFT/ Current category	2.33%	2.24%

(c). Sale and transfer to/from HTM category - **No Such Case Found.**

(d). Non-SLR Investment portfolio

(i). Non-performing non-SLR investments

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	Current Year(2022-23)	Previous Year(2021-22)
A	Opening balance	0.06	0.06
B	Additions during the year since 1st April	-	-
C	Reductions during the above period	0.06	0.06
D	Closing balance	0.00	0.00
E	Total provisions held	0.06	0.06



(e). Issuer composition of non-SLR investments

(Amount in ₹ crore)

Sr. No	Issuer	Amount		Extent of Private Placement		Extent of Below Investment Grade Securities		Extent of Unrated Securities		Extent of Unlisted Securities	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
1	2	3		4		5		6		7	
a	PSUs	-	-	-	-	-	-	-	-	-	-
b	FIs	-	-	-	-	-	-	-	-	-	-
c	Banks	-	-	-	-	-	-	-	-	-	-
d	Private Corporates	-	-	-	-	-	-	-	-	-	-
e	Subsidiaries/ Joint Ventures	-	-	-	-	-	-	-	-	-	-
f	Others	0.00	0.06	-	-	-	-	-	-	0.00	0.06
g	Provision held towards Depreciation	0.06	0.06	-	-	-	-	-	-	0.06	0.06
	Total	-0.06	0.06	-	-	-	-	-	-	-0.06	0.06

4. Asset Quality

a). Classification of advances and previous held

(Amount in ₹ crore)

	Standard	Non-Performing				Total
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss	Total Non-Performing Advances	
Gross Standard Advances and NPAs						
Opening Balance	211.02	1.68	8.85	-	10.53	221.55
Add: Additions during the year					-	-
Less: Reductions during the year*					0.54	-
Closing balance	225.78	1.87	8.12	-	9.99	235.77
*Reductions in Gross NPAs due to:	-	-	-	-	-	-
i) Upgradation					-	-



ii) Recoveries (excluding recoveries from upgraded accounts)					0.54	-
iii) Technical/ Prudential 16 Write-offs					-	-
v) Write-offs other than those under (iii) above					-	-
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	1.24				7.87	9.11
Add: Fresh provisions made during the year					0.87	1.07
Less: Excess provision reversed/ Write-off loans					-	-
Closing balance of provisions held	1.44				8.74	10.18
Net NPAs						
Opening Balance		-	-	-	2.66	213.66
Add: Fresh additions during the year					-	-
Less: Reductions during the year					1.41	-
Closing Balance		-	-	-	1.25	227.03
Floating Provisions						
Opening Balance		-	-	-	-	-
Add: Additional provisions made during the year		-	--	-	--	-
Less: Amount drawn down during the year		-	-	-	-	-
Closing balance of floating provisions		-	-	-	-	-

Ratios (in per cent)	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	4.24%	4.75%
Net NPA to Net Advances	0.55%	1.24%
Provisional coverage Ratio \$	87.49%	74.83%

\$ Total P & L a/c/NPA*100



(b). Sector-wise Advances and Gross NPAs

Sr, No	Sector	Current Year			Previous Year		
		Outstanding As On 31.03.2023	NPA	%	Outstanding As On 31.03.2022	NPA	%
I)	Priority Sector						
a	Agriculture and allied activities	1.85	0.02	0.20	1.88	0.04	0.38
b	MSMEs	46.78	4.25	42.54	49.81	4.71	44.77
c	Housing	9.70	0.00	0.00	12.36	0.00	0.00
d	Others	48.05	2.66	26.62	41.80	1.88	17.87
	Subtotal (i)	106.38	6.93	69.36	105.85	6.63	63.02
II)	Non-priority Sector	129.39	3.06	30.64	115.70	3.89	36.98
a	Agriculture and allied activities	0.00	0.00	0.00	0.00	0.00	0.00
b	Industry	0.00	0.00	0.00	0.00	0.00	0.00
c	Services	0.00	0.00	0.00	0.00	0.00	0.00
d	Others	129.39	3.06	30.64	115.70	3.89	36.98
	Sub-Total (ii)	129.39	3.06	30.64	115.70	3.89	36.98
	Total (I + II)	235.77	9.99	100.00	221.55	10.52	100.00

*Banks shall also disclose in the format above, sub-sectors where the outstanding advances exceeds 10 percent of the outstanding total advances to that sector. For instance, if a bank's outstanding advances to the mining industry exceed 10 percent of the outstanding total advances to 'Industry' sector it shall disclose details of its outstanding advances to mining separately in the format above under the 'Industry' sector.

(c). Details of accounts subjected to restructuring

		Agri & allied activity		Corporates (excluding MSME)		Micro, Small and Medium Enterprises (MSME)		Retail (excluding agriculture and MSME)		Total	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
Standard	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	-
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	-



Substandard	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	
Doubtful	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	
Total	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	

(e). Disclosure of transfer of loan exposures.

During the period under consideration, Bank has not transferred or acquired any loan as outlined in RBI circular.

(f). Fraud accounts

	Current year	Previous year
Number of frauds reported	NIL	NIL
Amount involved in fraud (₹ crore)	NIL	NIL
Amount of provision made for such frauds (₹ crore)	NIL	NIL
Amount of Unamortised provision debited from 'other reserves' as at the end of the year (₹ crore)	NIL	NIL

(g). Disclosure under Resolution Framework for COVID—19—related

(Amounts in ₹ Crore)

Type of borrower	Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan— Position as at the end of the previous half-year (A)	Of (A), aggregate debt that slipped into NPA during the half year	Of (A) amount written off during the half-year	Of (A) amount paid by the borrowers during the half- year	Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan – Position as at the end of this half-year
Personal Loans	-	-	-	-	-



Corporate persons	-	-	-	-	-
Of which MSMEs	-	-	-	-	-
Others	-	-	-	-	-
Total	-	-	-	-	-

* As defined in section 3(7) of the Insolvency and Bankruptcy Code, 2016

5. Exposures

a). Exposure to real estate sector

(Amount in ₹ crore)

Category	Current year	Previous Year
i) Direct exposure	27.56	22.22
a) Residential Mortgages – Lending fully secured by mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non-fund based (NFB) limits.		
b) Commercial Real Estate – Lending secured by mortgages on commercial real estate (office buildings, retail space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and construction, etc.). Exposure would also include non-fund based (NFB) limits;	11.11	11.52
c) Investments in Mortgage-Backed Securities (MBS) and other securitized exposures –		
i. Residential		
ii. Commercial Real Estate		
iii) Indirect Exposure Fund based and non-fund-based exposures on National Housing Bank and Housing Finance Companies.		
Total Exposure to Real Estate Sector	38.56	33.74

(b) Risk Category-wise country exposure

The Bank has no exposure to country risk

(c). Unsecured Advances

(Amount in ₹ crore)

Particulars	Current year	Previous Year
Total unsecured advances of the bank	3.77	3.92
Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	-	-
Estimated value of such intangible securities	-	-

(d) Factoring Exposure

The Bank had not undertaken any Factoring business during the year.



6. Concentration of deposits, advances, exposures and NPAs

a) Concentration of deposits

(Amount in ₹ crore)

Particulars	Current Year (2022-23)	Previous Year (2021-22)
Total deposits of the twenty largest depositors	14.38	17.75
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	3.94%	5.05%

b). Concentration of advances*

(Amount in ₹ crore)

Particulars	Current year	Previous Year
Total advances to the twenty largest borrowers	39.09	37.19
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	16.58%	16.78%

*Advances shall be computed based on credit exposure i.e. funded and non-funded limits including derivative exposures where applicable. The sanctioned limits or outstanding, whichever are higher, shall be reckoned. However, in the case of fully drawn term loans, where there is no scope for re-drawl of any portion of the sanctioned limit, banks may reckon the outstanding as the credit exposure.

c). Concentration of exposures

(Amount in ₹ crore)

Particulars	Current year	Previous Year
Total exposure to the twenty largest borrowers/customers	42.06	40.51
Percentage of exposures to the twenty largest borrowers/ customers to the total exposure of the bank on borrowers/ customers	17.84%	18.28%

Note: Outstanding balance of respective year has been considered in denomination for ratio calculation.

d) Concentration of NPAs

(Amount in ₹ crore)

Particulars	Current year	Previous Year
Total Exposure to the top twenty NPA accounts	6.21	6.01
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs	62.16%	57.07%



7. Derivatives

Bank has not entered into any derivative transaction during current and previous year.

8. Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amount in ₹ crore)

Sr.No.	Particulars	Current year	Previous Year
i)	Opening balance of amounts transferred to DEA Fund	1.79	1.49
ii)	Add: Amounts transferred to DEA Fund during the year	0.29	0.35
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.04	0.05
iv)	Closing balance of amounts transferred to DEA Fund	2.04	1.79

9. Disclosure of complaints

a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Ombudsman.

(Amount in ₹ crore)

Sr.No.		Particulars	Previous Year(2021-22)	Current year(2022-23)
Complaints received by the bank from its customers				
1.		Number of complaints pending at beginning of the year	NIL	NIL
2.		Number of complaints received during the year	NIL	NIL
3.		Number of complaints disposed during the year	NIL	NIL
	3.1	Of which, number of complaints rejected by the bank	NIL	NIL
4.		Number of complaints pending at the end of the year	NIL	NIL
Maintainable complaints received by the bank from Office of Ombudsman				
5.		Number of maintainable complaints received by the bank from Office of Ombudsman	NIL	NIL
	5.1	Of 5, number of complaints resolved in favour of the bank by Office of Ombudsman	NIL	NIL
	5.2	Of 5, number of complaints resolved through conciliation/mediation/advisories issued by Office of Ombudsman	NIL	NIL
	5.3	Of 5, number of complaints resolved after passing of Awards by Office of Ombudsman against the bank	NIL	NIL
6.		Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	NIL	NIL

Note: Maintainable complaints refer to complaints on the grounds specifically mentioned in Integrated Ombudsman Scheme, 2021 (Previously Banking Ombudsman Scheme, 2006) and covered within the ambit of the Scheme.



12 Other Disclosures

a) Business ratios

Particulars	Current Year	Previous Year
i) Interest Income as a percentage to Working Funds	7.92 %	7.95 %
ii) Non-interest income as a percentage to Working Funds	0.18 %	0.06 %
iii) Cost of Deposits	5.06 %	5.15 %
iv) Net Interest Margin	3.99 %	3.94 %
v) Operating Profit as a percentage to Working Funds	1.27 %	1.35 %
vi) Return on Assets	0.76 %	0.74 %
vii) Business (deposits plus advances) per employee (in crore)	7.70	7.44
viii) Profit per employee (in □ crore)	0.04	0.04

(b). Bancassurance business

Sr.No	Particulars	Current Year	Previous Year
1	NIL	NIL	NIL
2	NIL	NIL	NIL

(c). Disclosures regarding Priority Sector Lending Certificates (PSLCs)

Sr No	Particulars---Category	PSLCs ---Amount
1	Priority Sector lending	Nil
2	Weaker Section Advances	Nil
3	Micro Finance	Nil

(d). Provisions and contingencies

(Amount in ₹ crore)

Particular	Current Year	Previous Year
i) Provision for NPI (IDR)	0.00	0.00
ii) Provisions towards NPA	0.41	0.10
iii) Provision made towards Income Tax	0.00	0.00
iv) Other Provisions and Contingencies (with details)		
a) Renovation Fund	0.20	0.30
b) Investment depreciation	0.45	0.15
c) Investment Fluctuation	0.00	0.15
d) Conti. Against Standard asset	0.20	0.35
e) Staff Leave (Including PL & SL)	0.40	0.61
f) Computer & Technology Dev Fund	0.20	0.25
g) Member gift	0.25	0.30
h) Cyber cell	0.05	0.10



b). Top five grounds of complaints received by the bank from customers

Grounds of complaints (i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5 number of complaints pending beyond 80 days
1	2	3	4	5	6
2022-2023					
ATM service Related	0	0	0	0	0
IMPS/UPI/Digital services related	0	0	0	0	0
Others	0	0	0	0	0
Total	0	0	0	0	0
2021-2022					
ATM service Related	0	0	0	0	0
IMPS/UPI/Digital services related	0	0	0	0	0
Others	0	0	0	0	0
Total	0	0	0	0	0

10. Disclosure of penalties imposed by the Reserve Bank of India

Sr No	Particulars	Amount
NIL		

11. Disclosures on remuneration

Sr No	Particulars	Current Year	Previous Year
NIL			

(e). Payment of DICGC Insurance Premium

(Amount in ₹ crore)

Sr No.	Particulars	Current Year	Previous Year
I	Payment of DICGC Insurance Premium	0.44	0.40
ii	Arrears in payment of DICGC premium	0.00	0.00

(f). Disclosure of facilities granted to directors and their relatives.

Particular	Sanction Amount	Outstanding as on 31.03.2023
Fund based (FDOD)	0.00	0.00
Non fund based	0.00	0.00

12. Suppliers / service providers covered under Micro, Small, Medium Enterprises Development Act, 2006, have not furnished the information regarding filing of necessary memorandum with the appropriate authority. Therefore, information relating to cases of delays in payments to Micro and Small enterprise or of interest payments due to delays in such payments could not be given.



Disclosure of Information in noted on accounts as required by RBI circular are as under.

(Rs. In Crore)

Sr.	Particulars	As on 31/03/2023		As on 31/03/2022	
1	Overall CRAR %	11.42%		11.75%	
2	SLR Investments				
	Central Government Securities				
	a) Book Value of Investments	113.97		108.23	
	b) Face Value of Investments	114.50		108.50	
	c) Market Value of Investments	107.22		105.04	
3	Non-SLR Investments	0.06		0.06	
	Sr. No.	Issuer	Amount	Amount	
	1	PSUs	0.00	0.00	
	2	FIs	0.00	0.00	
	3	Public Sector Banks	0.00	0.00	
	4	Mutual Funds	0.00	0.00	
	5	Others	0.06	0.06	
	6	Provision Held towards Depreciation	0.00	0.00	
4	Non-performing Non SLR Investment				
	Opening Balance	0.00		0.00	
	Addition during the year	0.00		0.00	
	Reduction during the year	0.00		0.00	
	Closing Balance	0.00		0.00	
	Provision Made	0.00		0.00	
5	Advances against real estate, construction business, housing	38.68		33.74	
6	Advances against shares & debentures	0.00		0.00	
7	Advances to directors, their relatives, companies / firms in which they are interested Note :- (Loan Against Fix Deposit)	0.01		0.03	
8	Cost of Deposits: Average cost of deposits	5.06%		5.15%	
9	Movement in NPAs	31/03/2023 (In %)	31/03/2022 (In %)		
	a) Gross NPAs	4.24	4.75	9.99	10.53
	b) Net NPAs	0.55	1.24	1.24	2.65
	c) Provision Held			8.74	7.87
10	Profitability:				
	a) Interest income as a percentage of working funds	7.92		7.68	
	b) Non-interest income as a percentage of working funds	0.18		0.06	
	c) Operating profit as a percentage of working funds	1.27		1.31	
	d) Return on Assets	0.76		0.74	
	e) Business (Deposits + Advances) per employee	7.70		7.44	
	f) Profit per employee (Rs. In Lakhs)	4.13		3.90	
11	Provisions made towards NPAs, depreciation in investments, Standard Assets	11.88		10.34	
12	Movement in provisions:				
	a) Towards NPAs	8.74		7.88	
	b) Towards depreciation on investments	1.70		1.22	
	c) Towards standard assets	1.44		1.24	
13	Foreign currency assets & liabilities: (if applicable)				
	a) Assets	0.00		0.00	
	b) Liabilities	0.00		0.00	
14	Payment of DICGC Insurance Premium:	0.40		0.40	
15	Penalty imposed by RBI:	0.00		0.00	
16	Details of Restructured Accounts	0.00		0.00	
17	Fixed Assets- Valuation/ Revaluation	0.00		0.00	
18	DEAF Scheme 2014				
		31/03/2023		31/03/2022	
		No.of Ac.	Amount	No.of Ac.	Amount
	Opening balance of amounts transferred to DEAF	10275	1.79	9664	1.49
	Add:amounts transferred to DEAF during the year	605	0.29	667	0.35
	Less:amounts reimbursed by DEAF towards claims	97	0.04	56	0.05
	Closing balance of amounts transferred to DEAF	10783	2.04	10275	1.79



ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ

નાગરિક બેંક ચાર રસ્તા, કોલેજ રોડ, કલોલ (ઉ.ગુ.)

સભાસદો તથા ગ્રાહકોને વિનંતી કે....

- ❖ આથી તમામસભાસદ મિત્રોને જણાવવાનું કે તેમનો પોતાનો સભાસદ નંબર, નામ તથા આપણી બેંકનો સેવિંગ્સ (બચત) ખાતા નંબર આપવા વિનંતી.
- ❖ જો પેટીના સભાસદ હોય તો તેમની પેટીનો સભાસદ નંબર પેટીનું નામ તેમજ કરન્ટ ખાતા નંબર આપવો.
- ❖ જો આપનું સેવિંગ્સ/કરન્ટ ખાતું ન હોય તો આપણી બેંકમાં ખાતું ખોલાવવા વિનંતી.
- ❖ દરેક સભાસદો, ખાતેદારોએ તેમના કોન્ટેક ટેલીફોન નંબર/મોબાઇલ નંબર તેમજ **KYC** ના પુરાવા બેંકમાં સત્વરે રજુ કરવા. દરેક સભાસદો, ખાતેદારોએ તેમના ખાતામાં નોમીનેશનનું નામદાખલ કરવું દરેક લોકર ખાતેદારોએ લોકરની ચાવી પર (બેંક કોર્ડ) એમ્બોસીંગ સત્વરે કરાવી લેવું.
- ❖ વ્યક્તિગત સભાસદ અને પેટીના સભાસદના સરનામા તથા બેંકમાં ચાલતા તેમના ખાતામાં નામ તથા સરનામા સરખા હોવા જોઈએ. જો સરનામાં ફેરફાર હોય તો પુરાવા રજુ કરી સરનામાં ફેરફાર કરાવી લેવા વિનંતી.
- ❖ સદર માહિતી ડિવિડન્ડની રકમખાતામાં જમા (ટ્રાન્સફર) કરવાના હોવાના કારણે બેંકની નજીકની જે તે શાખામાં રજુ કરી સાથ-સહકાર આપવા વિનંતી.
- ❖ દરેક લોકર ધારકો, સભાસદો તથા બચત-ચાલુ-થાપણદારોએ **CKYCR** પુર્તતા-પુરાવો ફોર્મ, આધારકાર્ડ, પાનકાર્ડ સાથે તાત્કાલીક પૂર્ણ કરાવી જવા વિનંતી.
- ❖ આપના **RUPAY CARD** કાર્ડ વિશેની કોઈપણ જાતની માહિતી અન્ય કોઈપણ વ્યક્તિને જણાવશો નહીં.
- ❖ આપના ખાતામાં નિયમિત વ્યવહાર કરશો. ૧૦ વર્ષ થી વધુ સમયથી વ્યવહાર કરવામાં નહિં. રાવે તેવા ખાતાનું બેલેન્સ રિઝર્વ બેંકમાં જમા કરાવવામાં આવશે.

શ્રી પરેશભાઈ આર. જોષી

જનરલ મેનેજરશ્રી



ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, કલોલ (ઉ.ગુ.)

ધીરાણ લેનાર સભાસદોને અગત્યની સૂચના

- (૧) લોન માંગણીની અરજી દરેક મહિના ની પંદર મી તારીખ પહેલા જ રજુ કરવી તે પછી રજુ થયેલ અરજી ઓની વિચારણા તે માસમાં બેન્ક પોતાની સગવડતાએ જ કરશે.
- (૨) કરજ માંગણી સાથે જેટલી રકમ માંગણી હોય તેથી વધુ રકમની સ્વતંત્ર સ્થાવર મિલકતના દાખલાઓ કરજદાર અથવા જામીનદારોના રજુ કરવાના રહેશે.
- (૩) ધંધાકીયા હેતુ માટેની કરજ માંગણી સાથે જરૂરી કાગળો જેવા કે સરવૈયું, નફા-નુકશાન ખાતાનું પત્રક, સ્ટોક પત્રક, વ્યાપાર ખાતાના પત્રક, ઈન્કમેટેક્સ સેલેક્શન ઠરાવો, મકાનની ભાડાચીઠી અથવા માલિકીનો પુરાવો વગેરે લોન અરજી ફોર્મ સાથે અવશ્ય રજુ કરો.
- (૪) કરજદારોએ લોન અરજીમાં માંગેલ સઘળી માહિતી સંપૂર્ણ ભરવી જોઈએ. અધુરી વિગતોવાળા લોન અરજી ફોર્મ નામંજુર થવાને પાત્ર ગણાશે.
- (૫) લોનની રકમ પાકતી તારીખે ભરપાઈ કરવાની ખાસ ચોકસાઈ રાખવી મુદત વીતી બાકી રહે તો તે હકકીત કરજદારની પોતાની તથા જામીનોની શાખને હરકતરૂપ થાય છે.
- (૬) લોન પરત ભરવાની નિયમિત ટેવ રાખો જેમાં તમારી અને બેન્કની સધ્ધરતામાં વધારો થશે.
- (૭) આપ જેમના જામીન થયા હો તેમની પાસે બેન્કનું ધીરાણ ખાતું બેન્ક ના નિયમ મુજબ એન.પી.એ તેમજ મુદત વીતી લેણું પડે ત્યારે સક્રિય બની વસુલાત થાય તે માટે તમામ પ્રયત્નો કરશો.
- (૮) ધીરાણની રકમ નિયમિત નહીં ભરનાર સભાસદ મુદત વીતી બાકીદાર ગણાય છે. મુદત વીતી રકમ ઉપર ૩% વધારે વધારાનું વ્યાજ લેવામાં આવે છે. આથી ધીરાણની રકમ પરત ભરવામાં અનિયમિતતા કે બેકાળજી રાખવી કદી પણ પોષાય તેમ નથી.

શ્રીમતી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ

ચેરપર્સનશ્રી

શ્રી શ્રેણીકભાઈ અશોકભાઈ શાહ

મેનેજિંગ ડિરેક્ટરશ્રી

શ્રી રશ્મીકાંત અરવિંદભાઈ દેસાઈ

વાઈસ ચેરમેનશ્રી

શ્રી બાબુભાઈ પ્રભુદાસ પટેલ

બોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરશ્રી

શ્રી પરેશભાઈ રમેશચંદ્ર જોષી

જનરલ મેનેજરશ્રી/સી.ઈ.ઓ